

This Question Paper contains 20 printed pages.

(Part - A & Part - B)

Sl.No.

0900122

056(G)

(MARCH, 2019)

SCIENCE STREAM

(CLASS - XII)

Part - A : Time : 1 Hour / Marks : 50

Part - B : Time : 2 Hours / Marks : 50

પ્રશ્ન પેપરનો સેટ નંબર જેની  
સામેનું વર્તુળ OMR શીટમાં  
ધૂંકરવાનું રહે છે.  
Set No. of Question Paper,  
circle against which is to be  
darken in OMR sheet.

09

(Part - A)

Time : 1 Hour

/Maximum Marks : 50

સૂચનાઓ :

- 1) આ પ્રશ્નપત્રના ભાગ-A માં હેતુલક્ષી પ્રકારના 50 પ્રશ્નો છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
- 2) પ્રશ્નોની કમ સંખ્યા 1 થી 50 છે અને દરેક પ્રશ્નનો ગુણ 1 છે.
- 3) કાળજીપૂર્વક દરેક પ્રશ્નનો અભ્યાસ કરી સાચો વિકલ્પ પસંદ કરીને OMR શીટમાં જવાબ લખવો.
- 4) આપને અલગથી આપેલ OMR પત્રકમાં જે તે પ્રશ્ન નંબર સામે (A) O, (B) O, (C) O, (D) O આપેલા છે. તે પ્રશ્નનો જે જવાબ સાચો હોય તેના વિકલ્પ પરના વર્તુળને બોલપેનથી પૂર્ણ ધૂંકરવાનું રહેશે.
- 5) રફ કાર્ય હેતુ આ ટેસ્ટ બુકલેટમાં આપેલી જાણ્યા પર કરવાનું રહેશે.
- 6) પ્રશ્નપત્રમાં ઉપરની જમણી બાજુમાં આપેલા પ્રશ્નપત્રક સેટ નં. ને OMR પત્રકમાં આપેલી જાણ્યામાં લખવાનું રહેશે.

- 1) તે જળાશયનું પાણી સુકાઈ જાય ત્યારે વાતાવરણીય હવાનું શ્વસન કરવા સહાયક શ્વસનાંગો વિકસાવે છે.

રફ કાર્ય

- (A) યુરોમેટ્રિક્સ  
(B) ક્લેરિયસ  
(C) એસ્ટેક્સ  
(D) અમીબા

૨૬ કાર્ય

૨) જો કોઈ વસતિમાં જન્મદર અને મૃત્યુદર સરખાં હોય તો તેનો વધ-પિરામિડ X, જીવનશક્તિ સૂચક દર્શક આંક Y અને વસતિ Z

- (A)  $X = \text{ઘંટાકાર}$   
 $Y = 100$   
 $Z = \text{સમતુલન}$
- (B)  $X = \text{ત્રિકોણાકાર}$   
 $Y = < 100$   
 $Z = \text{સમતુલન}$
- (C)  $X = \text{ઉંઘા ઘડકાર}$   
 $Y = > 100$   
 $Z = \text{ઘટાડો}$
- (D)  $X = \text{ત્રિકોણાકાર}$   
 $Y = 0$   
 $Z = \text{વધારો}$

૩) નીચેનામાંથી વિધટકો માટે સાચું શું છે ?

- (A) સૂક્ષ્મ ઉપભોગીઓ, વિષમપોષી ઘટકો જેવા કે બેક્ટેરીયા
- (B) સૂક્ષ્મ ઉપભોગીઓ અને પર્યાવરણમાં કાર્બનિક પોષક દ્રવ્યો મુક્ત કરે છે.
- (C) મહાઉપભોગીઓ, વિષમપોષી જેવા કે ફૂગ
- (D) સૂક્ષ્મ ઉપભોગીઓ અને બધી જ પ્રકારની પોષણ શ્રુંખલા માટે મુખ્ય ઊર્જા સત્રોત છે.

૪) જંતુનાશકોનાં જૈવિક વિશાળન માટે આપેલ ચાર્ટમાંથી “P” અને “Q” માટે સાચો વિકલ્પ પસંદ કરો.

માઇલીભક્ષી પક્ષીઓ  $\rightarrow$  “Q”  
 $\uparrow$   $\uparrow$   
 મોટી માઇલીઓ  $\rightarrow$  2 ppm  
 $\uparrow$   $\uparrow$   
 નાની માઇલીઓ  $\rightarrow$  “P”  
 $\uparrow$   $\uparrow$   
 ગ્રાઝી ખંબકોમાં  $\rightarrow$  0.04 ppm  
 $\uparrow$   $\uparrow$   
 પાણીમાં  $\rightarrow$  X

- (A)  $P = 0.25 \text{ ppm}, Q = 0.04 \text{ ppb}$   
(B)  $P = 0.5 \text{ ppm}, Q = 25 \text{ ppm}$   
(C)  $P = 2.5 \text{ ppm}, Q = 25 \text{ ppm}$   
(D)  $P = 0.04 \text{ ppb}, Q = 2.5 \text{ ppm}$

- 5) કલોરીનનાં 6 પરમાણુ દ્વારા ઓડોનનાં કેટલાં આણુઓનું વિધટન થઈ શકે ? ૨૫ કાર્ય
- (A) 3,00,000
  - (B) 6,00,000,000
  - (C) 1,00,000
  - (D) 6,00,000
- 6) અનુકૂળી ચેતાતંત્ર માટે ક્યું સાચું છે ?
- (A) 'ગૃહજળવણીતંત્ર' કહેવાય છે.
  - (B) 'કટોકટી સ્થિતિ' માં ખાસ ઉપયોગી છે.
  - (C) એસિટાઇલ કોલાઇન-ચેતાપ્રેષક દ્રવ્ય.
  - (D) પૂર્વ ચેતાકંદીય તંત્રું પશ્ચ ચેતાકંદીય તંત્રું કરતાં લાંબો હોય છે.
- 7) કોલમ - I અને કોલમ - II માંથી સાચી જોડ દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

	કોલમ - I		કોલમ - II
P)	પ્લેનેરીથા	i)	અવખંડન
Q)	સાઈકોન	ii)	વિભાજન
R)	તારા-માછલી	iii)	બીજાણુસર્જન
S)	પ્લાઝમોડીથમ	iv)	કલિકસર્જન

- (A) (P - iv) (Q - ii) (R - i) (S - iii)
- (B) (P - i) (Q - iii) (R - ii) (S - iv)
- (C) (P - iv) (Q - i) (R - ii) (S - iii)
- (D) (P - ii) (Q - iv) (R - i) (S - iii)

## ૨૬ કાર્ય

8) સરટોલી કોષો માટે ક્યો વિકલ્પ સાચો છે ?

- (A) તે શુક્કોષોને પોખરણ પુરું પાડે છે.
- (B) તે ટેસ્ટોસ્ટોરોનનો સ્ત્રાવ કરે છે.
- (C) તે વીર્યનો સ્ત્રાવ કરે છે.
- (D) તે શુક્કોષોને ઉત્સેણી કરે છે.

9) ન્યુક્લિક એસિડ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

- (A) જીનીનિક માહિતીનાં સ્થળાંતરણ માટે DNA વધુ સુયોગ છે.
- (B) DNA વિકૃતિ પામી રહે, RNA વિકૃતિ પામતાં નથી.
- (C) DNA અને RNA બંને જીનીન દ્રવ્ય તરફિક કાર્ય કરે છે.
- (D) પ્રોટીન સંસ્થેપણ માટે DNA સીધો જ સંકેત કરી રહે છે.


10) બોગનવેલનાં કંટકો અને કુકરબીટાનાં સૂત્રો સમભૂલક અંગો છે કારણ કે.....

- (A) સમાન કાર્ય અને અસમાન ગર્ભરચના
- (B) સમાન ગર્ભરચના અને અસમાન કાર્ય
- (C) સમાન ગર્ભરચના અને સમાન કાર્ય
- (D) અસમાન ગર્ભરચના અને અસમાન કાર્ય

11) તે પ્રાણીકોષોમાં ઈચ્છિક જીનીનનાં પ્રવેશ માટે આવશ્યક છે.

- (A) રીટ્રોવાઈરસ
- (B) HIV વાઈરસ
- (C) રાઈઝોબિયમ
- (D) આપેલ એકપણ નહીં

12) પેલિન્ડ્રોમીક શ્રુંખલાનાં બેઈડની જોડ માટે કયું સાચું છે ?



13) પ્રથમ પારજનીનિક ગાય (Rosie)માંથી મળતા દૂધમાં .....પ્રોટીન હોય છે.

- (A) આલ્ફા લેક્ટાલ્બ્યુમીન, 2.4 gm/litre
- (B) બીટા લેક્ટાલ્બ્યુમીન, 2.4 mg/litre
- (C) આલ્ફા લેક્ટાલ્બ્યુમીન, 2.4 mg/litre
- (D) આલ્ફા હિસ્ટોન, 2.4 gm/litre

14) કેલ્વિન ચક દરમ્યાન જીકોડનાં 5 આણુઓનાં સંશોષણ માટે ATP નાં કેટલાં આણુઓ જરૂરી છે ?

- |         |        |
|---------|--------|
| (A) 180 | (B) 45 |
| (C) 90  | (D) 05 |

૨૬ કાર્ય

15) વિઘટનની પ્રક્રિયા માટે સાચો વિકલ્પ પસંદ કરો.

જ્ઞાન a = અવખંડન

b = અપચય

c = ધોવાણ

- |               |               |
|---------------|---------------|
| (A) b → c → a | (B) a → b → c |
| (C) c → b → a | (D) a → c → b |


16) બટાકાનાં એકકીય કોષોમાં રંગસૂતોની સંખ્યા કેટલી હોય છે ?

- |        |        |
|--------|--------|
| (A) 48 | (B) 24 |
| (C) 12 | (D) 06 |

17) શુક્કોષજનનની કિયા દરમ્યાન દૂરસ્થ તારકેન્દ્રો શું બનાવે છે ?

- |                          |
|--------------------------|
| (A) પ્રશુક્તાગ્ર કાંઝિકા |
| (B) શુક્તાગ્ર            |
| (C) અક્ષીય તંતુ          |
| (D) ગોળીકાયની રસધાનીઓ    |

18) આકૃતિમાં 'X' શું દર્શાવે છે ?



- |                           |
|---------------------------|
| (A) લઘુગુણકીય તબક્કો      |
| (B) ઋણાત્મક પ્રવેગ તબક્કો |
| (C) ધનાત્મક પ્રવેગ તબક્કો |
| (D) વસતિમાં વધારો - ઘટાડો |

૨૬ કાર્ય

19) વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા માટે સાચો વિકલ્પ પસંદ કરો.

- (A)  $NPP = \text{શ્વસનની ડિયાને લીધે થયેલ ઘટ - GPP}$
- (B)  $NPP = GPP + \text{જૈવભારમાં શ્વસનથી થતી વૃદ્ધિ}$
- (C)  $NPP = GPP + \text{શ્વસનની ડિયાને લીધે થયેલ ઘટ}$
- (D)  $NPP = GPP - \text{શ્વસનની ડિયાને લીધે થયેલ ઘટ}$

20) GMO નું પૂર્ણ નામ .....

- (A) Genetically Modified Organ
- (B) Genetically Modified Organism
- (C) Genetically Made Organism
- (D) Genetic Mode of Organism

21) પુષ્ટ ઈન્સ્યુલિનમાં A શ્રુંખલામાં X એમિનોએસિડ, B શ્રુંખલામાં Y એમિનોએસિડ અને C - પેટાઈડ = Z હોય છે.

- (A)  $X = 21$   
 $Y = 30$   
 $Z = ગેરહાજર$
- (B)  $X = 21$   
 $Y = 30$   
 $Z = હાજર$
- (C)  $X = 30$   
 $Y = 21$   
 $Z = ગેરહાજર$
- (D)  $X = 30$   
 $Y = 51$   
 $Z = હાજર$

૨૬ કાર્ય


22) સાચો વિકલ્પ પસંદ કરો.

- (A) દ્વિયોનું સેકેન્ડ્રાશ વધે, તો  $\Psi_s$  નું મૂલ્ય વધે છે.
- (B)  $\Psi_p$  નું ધન મૂલ્ય આશ્લૂનાબ કહેવાય છે.
- (C) પાણી કોષમાં પ્રવેશે ત્યારે  $\Psi_p$  નું મૂલ્ય ઘટે છે.
- (D) દીવાલનું દ્વાંશ અને આશ્લૂનાબ અસમાન અને સમાન હિસામાં હોય છે.

23) ફળનાં ઉત્પાદન અને રાહરાનાં વહનમાં ઘટાડા જેવી અસરને દૂર કરવા જગીનમાં કયાં કારોનો ઉમેરો કરશો ?

- (A) N, S
- (B) Fe, Mn
- (C) Cl, B
- (D) Zn, Cu

24) આપેલ આકૃતિ અને તેમાં 'a' દ્વારા નિર્દેશિત ભાગ માટે સાચો વિકલ્પ પસંદ કરો.



- (A) C<sub>4</sub> પથ, પાયડિવિક એસિડ
- (B) C<sub>3</sub> પથ, રૂબિસ્કો (RuBisCo)
- (C) C<sub>4</sub> પથ, મેલિક એસિડ-ડી-કાર્બોક્સિલેઝ
- (D) પ્રકારા ખસન, રૂબિસ્કો (RuBisCo)

૨૬ કાય

- 25) એફિલોલિક પથ માટે આપેલ વિધાનોમાંથી બધાં સાચાં વિધાન માટે સાચો વિકલ્પ પસંદ કરો.

I - લિપિડનું શ્વર્ણન પથની પ્રથમ અવસ્થામાં પ્રવેશ થાય છે.

II - કાર્બોનિટનું શસનમાં પ્રવેશતાં પહેલાં ઝૂકોજમાં રૂપાંતરણ આવશ્યક નથી.

III - પ્રોટીન પાથેઝિક એસિડ રૂપે શ્વસન પથમાં પ્રવેશો છે.

IV - પ્રોટીન અને લિપિડનું ઓક્સિડેશન અને નિર્માણ એમ બે ઘટનાઓ સંકળાયેલ છે.



- 26) ઇધરના માધ્યમથી વહન પામતું કયું રસાયણ માનવમાં પ્રોટીનનાં પાચનની શક્યાત કરે છે ?


- (A) જઠરરસ (B) ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવ  
(C) ટ્રીપ્સીનોજન (D) ટ્રીપ્સીન

- 27) સામાન્ય રીતે ઈન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ (IRV) ..... ની વચ્ચે હોય છે.

- (A) 2500 ml. થી 3000 ml.
  - (B) 1000 ml. થી 1100 ml.
  - (C) 1500 ml. થી 1600 ml.
  - (D) 3000 ml. થી 3500 ml.

- 28) મનુષ્યમાં એક હૃદય ચક્ર દરમ્યાન કોપકમાં કુલ કેટલા સમય માટે ડાયસ્ટોલ થાય છે ?

29) આપેલ મૂત્ર નિર્માણની આકૃતિમાં "X" અને "Y" કઈ હિસ્સા થાય છે ?



(A) X = નલિકા સ્ત્રાવ

Y = દાખ ગાળણ

(B) X = નલિકા પુનઃશોષણ

Y = નલિકા સ્ત્રાવ

(C) X = નલિકા પુનઃશોષણ

Y = દાખ ગાળણ

(D) X = દાખ ગાળણ

Y = નલિકા સ્ત્રાવ

30) સાધનોવિધલ કલામાં સોજો આવવો એ તેનું મુખ્ય લક્ષણ છે.

(A) ડ્રેટાઇડ આર્થાઈટિસ

(B) ગાઉટી આર્થાઈટિસ

(C) ઓસ્ટીઓ આર્થાઈટિસ

(D) ઓસ્ટીઓ પોરોસીસ

31) કોલમ - I અને કોલમ - II માટે સાચી જોડ દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

૨૬ કાર્ય

	કોલમ - I		કોલમ - II
i)	પ્રતિજ્ઞાવન	P)	એકને લાલ બીજાને નુકશાન
ii)	પરભક્ષણ	Q)	બંનેને લાલ
iii)	સહલોજિતા	R)	એકને નુકશાન બીજાને અસર થતી નથી.
iv)	પરસ્પરતા	S)	એકને લાલ બીજાને અસર થતી નથી.

- (A) (i - R) (ii - P) (iii - Q) (iv - S)
- (B) (i - R) (ii - S) (iii - Q) (iv - P)
- (C) (i - P) (ii - R) (iii - Q) (iv - S)
- (D) (i - R) (ii - P) (iii - S) (iv - Q)

32) CAM વનસ્પતિઓ માટે શું સાચું છે ?

- (A) જલીય વનસ્પતિઓ માટે અનુકૂલન છે.
- (B)  $\text{CO}_2$  દિવસ દરમ્યાન અકાર્બનિક એસિડમાંથી મુક્ત છે.
- (C)  $\text{CO}_2$  નું રાત્રિ દરમ્યાન શોખણા થાય છે અને અકાર્બનિક એસિડમાં રૂપાંતર થાય છે.
- (D) વાયુરંધ્ર રાત્રિ દરમ્યાન ખૂલ્લાં રહે છે.

33) આપેલ વિધાન માટે સાચો વિકલ્પ પસંદ કરો (જ્યાં a = કોલમ્બિયા, b = ન્યૂયૉર્ક)

#### વિધાન

X = "a" માં પક્ષીઓની જાતિઓની સંખ્યા "b" કરતાં વધુ છે.

Y = "a" કરતાં "b" માં વધુ સૂર્ય ઊર્જા પ્રાપ્ત થાય છે.

Z = "a" ની ઉત્પાદકતા "b" કરતાં વધુ છે.

- (A) X અને Y સાચું અને Z ખોટું છે.
- (B) X અને Z સાચું, Y-ખોટું અને Z એ X-ની સાચી સમજ આપે છે.
- (C) X, Y અને Z સાચું અને Y તથા Z એ X ની સાચી સમજ આપે છે.
- (D) X અને Z ખોટા અને Y સાચું.

૨૬ કાર્ય

34) તે 'ટેરર ઓફ બેંગાલ' તરફ જાણીતું છે.

- (A) આઈકોન્નિયા કેસીપીસ  
 (B) ઓસ્સીમ્બ સેક્ટમ  
 (C) ક્રેનિયસ ગેરીપીનસ  
 (D) પોલીઆલ્થીઆ લોન્જુફોલીઆ

35) વ્યક્તિ 'P' ને દશિની પરાવર્તી કિયાનાં નિયંત્રણમાં તકલીફ છે અને વ્યક્તિ 'Q' ને તાપમાન અને દર્દનાં અનુભવ સંબંધી તકલીફ છે. તો મગજનાં ક્યા ભાગમાં ખામી હોવાની શક્યતા છે ?

- (A) P = ઇન્ફિરિયર કોલીક્યુલી  
 Q = મધ્ય કપાલી ખંડ  
 (B) P = સુપીરિઅર કોલીક્યુલી  
 Q = ઇન્ફિરિયર કોલીક્યુલી  
 (C) P = સુપીરિઅર કોલીક્યુલી  
 Q = મધ્ય કપાલી ખંડ  
 (D) P = પશ્ચ કપાલી ખંડ  
 Q = મધ્ય કપાલી ખંડ


36) કોલમ - I અને કોલમ - II ની સાચી જોડ દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

	કોલમ - I		કોલમ - II
i)	જેક્સ્ટા સોમેક્સર કોષો	a)	સોમેટોસ્ટેટીન
ii)	સ્વાદુપિંડનાં $\beta$ -કોષો	b)	ખુકાળોન
iii)	સ્વાદુપિંડનાં $\alpha$ -કોષો	c)	એરિથ્રોપોઇટીન
iv)	સ્વાદુપિંડનાં ડેલ્ટા-કોષો	d)	ઇન્સ્યુલિન

- (A) (i - b) (ii - c) (iii - a) (iv - d)  
 (B) (i - a) (ii - d) (iii - b) (iv - c)  
 (C) (i - a) (ii - b) (iii - d) (iv - c)  
 (D) (i - c) (ii - d) (iii - b) (iv - a)

C - 12

૨૬ કાર્ય



ਕਲਾਵੀਆ

- (A) મૂળ (B) પર્યાપ્ત  
(C) પ્રકાદ (D) કથ્કલિકા

38) આવુતબીજધારી વનસ્પતિઓનાં ભૂણપુટ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

- (A) અંડાલ તરફ ન્રાણ દ્વિકીય( $2n$ ) પ્રતિધ્રુવકોષો આવેલ હોય છે.

(B) તેમાં ત્રિકીય દ્વિતીયક કેન્દ્ર મધ્યમાં હોય છે.

(C) બ્લૂઝપોષપેશી ફલન પહેલા ઉત્પન્ન થાય છે.

(D) અંડસાધનમાં એક અંડકોષ અને બે સહાયક કોષ આવેલ હોય છે.

39) તે જનીનિક વામનતાની અભિવ્યક્તિને દૂર કરે છે.

- (A) સાઈટોકાઈન્નીસ (B) ઓડિઝિન્સ  
(C) જીબરેલિન્સ (D) ABA

40) પ્રથમ ૪ અઠવાડિયાનાં વિકાસ બાદ ગર્ભને ..... કહે છે.

- (A) મોડલા ગર્ભ (B) ગર્ભકોષી અવસ્થા  
 (C) બ્રાંશ (D) કોર્પસલ્વુટિયમ

41) વસતિ નિયંત્રણાની અંતઃસ્વાવી પદ્ધતિમાં પિલ્સ ઋતુચ્કનાં 5 માં દિવસથી શરૂ કરી સતત ..... દિવસ સૂધી મુખ દ્વારા લેવામાં આવે છે.

૨૬ કાર્ય

- 42) આપેલ વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો.

विधान :

X - પિતા રંગઅંધ છે.

Y - તેની પૂર્વી રંગઅંધતા માટે વાહક અથવા રંગઅંધ હોઈ શકે છે.

- (A) X સાચું અને Y ખોટું છે.  
 (B) X અને Y બંને ખોટા છે.  
 (C) Y સાચું અને X ખોટું છે.  
 (D) X અને Y બંને સાચાં છે.

- 43) બે કાર્ય સાથે સંકળાયેલ જનીન સંકેત કયો છે ?



- 44) કયો વાદ રજૂ કરે છે કે જીવોનો ઉદ્ભબ પૂર્વ અસ્તિત્વ ધરાવતાં જીવોમાંથી થાય છે ?



- 45)  $\text{amp}^R$  જનીન ..... માટે ઓળખ જરૂરી ધરાવે છે.

- (A) Pst I  
 (B) Bam HI  
 (C) Hind III  
 (D) Sal I

- 46) બેસિલસ થુરિન્ઝાન્સીસ દ્વારા ઉત્પન્ન વિખારી પ્રોટીન માટે સાચો વિકલ્પ પસંદ કરો.

- (A) તે મધ્યાંત્રની સપાટીનાં અધિયદ્ધીય કોષોને અપ્રવેશશરીર બનાવે છે.

(B) તે હંમેશા સક્રિય સ્વરૂપે ઉત્પન્ન થાય છે.

(C) સક્રિય વિખારી પ્રોટીન કણ સ્વરૂપે હોય છે.

(D) વિખારી પ્રોટીનનો સક્રિય સ્વરૂપ મધ્યાંત્રની સપાટી પરનાં અધિયદ્ધીય કોષોમાં ભેગું થાય છે.

૨૬ કાંઈ


- 47) ગુરુપોષક તત્ત્વોનું સંકેન્દ્રણ વનસ્પતિનાં શુષ્ણગળમાં ..... પ્રતિ ગ્રામ હોય છે.

- (A) 100 mg. કરતાં વધુ (B) 0.1 થી 1 mg.  
(C) 1 થી 10 mg. (D) 20 થી 40 mg.

- 48) તેમણે દર્શાવ્યું કે વનસ્પતિઓમાં લીલા પદાર્થો (હરિત દ્રવ્ય) વનસ્પતિ કોષની વિશિષ્ટ અંગિકા (હરિતકણ)માં આવેલા છે. આ લીલા પદાર્થો જુકોઝ ઉત્પન્ન કરે છે.

- (A) જોન ઈન્જિનિયરિસ  
 (B) કોર્પોરેશન વાન નીલ  
 (C) ભૂલિયસ વોન સેચ  
 (D) બ્લેક મેન

- 49) આપેલ ચાર્ટમાં X અને Y શું દર્શાવે છે ?





- 50) સ્નાયુ સંકોચન માટે આપેલ વિધાનમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

विधान :

X = એક્ટિનનાં તંતુકો માયોસીનનાં તંતુકો પર સરકે છે.

Y = હળવા મેરોમાયોસીન એક્ટિન સાથે જોડાય છે.

Z = अङ्कित के भायोसीन बनेमाथी कोई परेश साचा अर्थमां संकेचाता नथी.

- (A) X, Y અને Z ત્રણેથ સાચાં છે.  
(B) X અને Y ખોટા છે અને Z સાચું છે.  
(C) X અને Z સાચાં અને Y ખોટું છે.  
(D) X અને Y સાચું અને Z ખોટું છે.

**056(G)**

(MARCH, 2019)

SCIENCE STREAM

(CLASS - XII)

**(Part - B)***Time : 2 Hours]**[Maximum Marks : 50*સૂચનાઓ :

- 1) સ્પષ્ટ વંચાય તેવું હસ્તલેખન જાળવું.
- 2) આ પ્રક્રિપ્તના ભાગ-B માં ત્રણ વિભાગ છે અને કુલ 1 થી 18 પ્રશ્નો આપેલા છે.
- 3) બધા જ પ્રશ્નો ફરજિયાત છે. આંતરિક વિકલ્પો આપેલા છે.
- 4) પ્રશ્નની જમણી બાજુના અંક તેના ગુણ દર્શાવે છે.
- 5) નવો વિભાગ નવા પાના પર લખવો.
- 6) પ્રશ્નોના જવાબ ક્રમમાં લખવા.

વિભાગ - A

■ નીચે આપેલ 1 થી 8 સુધીના પ્રશ્નોના માઝ્યા પ્રમાણે ઉત્તર આપો. દરેક પ્રશ્નના 2 ગુણ છે. [16]

- 1) પ્રકાશ અવધિની સમજૂતી આપી, ગાડરિયું અને કાકડીમાં તેની ચર્ચા કરો.
- 2) ડાઉન્સ સીન્ટ્રોમમાં રંગસૂત્રીય અનિયાપિતતા બતાવી તેનાં કોઈપણ ત્રણ લક્ષણો જણાવો.
- 3) ચક્કીય અને અચક્કીય ફોટોફોસ્ફોરાયલેશનમાં તફાવતનાં 4 મુદ્દા લખો.

4) જૈવ વિવિધતાનું સરકારી આજની મુખ્ય જરૂરિયાત છે. તેની સમજૂતી સુસંગત આહાર શૃંખળાનાં ઉદાહરણ દ્વારા સમજાવો.

5) ગર્ભધારણની પરાકાષ્ઠા સમજાવો.

અથવા

ગર્ભાશયનાં હિવાલની રચના સમજાવો.

6) નાઈટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યનો પ્રકાર અને તેના ઉત્સર્જનનો આધાર પાણીની પ્રાપ્તિ ઉપર રહેલો છે. કોઈ બે ઉદાહરણ દ્વારા સમજાવો.

અથવા

વિધાનની ચર્ચા કરો : - વાસારેકટામાં કાઉન્ટરકરન્ટ કિયાવિધિ મૂર્ચિંડ મજજુકમાંથી સાંક્રતાનાં ઢોળાંશની જળવણીમાં મદદગર થાય છે.

7) મનુષ્યનાં અગ્રઉપાંગ અને પશ્ચઉપાંગ કંકાલની તુલના કરો.

8) જનનાંગીય હુર્પિસ માટે જવાબદાર વાહક અને તેનાં લક્ષણો લખો. (કોઈપણ ત્રણ)

### વિભાગ - B

■ નીચે આપેલ 9 થી 14 સુધીના પ્રશ્નોના ભાગ્યા પ્રમાણે ઉત્તર આપો. દરેક પ્રશ્નના 3 ગુણ છે. [18]

9) એડિનલ બાહ્યકનાં અંતઃસ્ત્રાવો વર્ણવો.

10) મનુષ્યમાં અસન્નનું નિયમન સમજાવો.

- 11) સમજાવો – ઉત્સવેદન ખેંચાણ સિદ્ધાન્ત.
- 12) અંતકર્ણની નામનિર્દેશિત આકૃતિ દોરી સાંભળવાની કિયાવિધિ સમજાવો.
- 13) સેન્ટ્રલ ડોઝા ચાર્ટ સાથે સમજાવો.

અથવા

HGP નાં કોઈ છ: વિશિષ્ટ લક્ષણો જગ્ઞાવો.

- 14) અન્નમાર્ગનાં દીવાલની સામાન્ય રચનાની ચર્ચા કરો અને અન્નમાર્ગનાં વિવિધ લાગોમાં જોવા મળતી લિન્નતાઓ સમજાવો.

### વિભાગ - C

- નીચે આપેલ 15 થી 18 સુધીના પ્રક્રોના ભાષ્યા પ્રમાણે સવિસ્તાર ઉત્તર આપો. દરેક પ્રક્રોના [16] 4 ગુણ છે.

- 15) બાહ્યમાર્ગનાં સંદર્ભમાં તૃધિરની જમાવટનાં દરેક તબક્કા વર્ણાવો.
- 16) લિંગનિશ્ચયનમાં લિંગીરંગસૂત્ર સિવાયનાં રંગસૂત્રનાં મહત્વ અંગે ચર્ચા કરો.  
અથવા  
સંપૂર્ણ સંલભતા ભાષ્યે જ જોવા મળે છે. યોઝ ઉદાહરણ દ્વારા સમજાવો.
- 17) કેબ્સ ચકનો ચાર્ટ દોરો અને તેમાં પાયકુલિક એસિડશી 5 - કાર્બન ધરાવતાં એસિડનાં નિર્માણ સુધીની કિયા સમજાવો.
- 18) આવૃત્તબીજધારી વનસ્પતિમાં ભૂગ વિકાસ સમજાવી હૃદ્યાકાર ભૂગ અવસ્થાની નામનિર્દેશિત આકૃતિ દોરો.

